

ત્વરિત જાહેરાત માટે

બ્રેમ્પટન ટ્રાન્ઝિટ માટે નોંધપાત્ર અપગ્રેડ્સ કરવા બ્રેમ્પટને \$7.3M નું ફેડરલ અને પ્રોવિન્સનું રોકાણ સુરક્ષિત કર્યું

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (મે 17, 2021) – આજરોજ, મેયર પેટ્રિક બ્રાઉન (Patrick Brown); બ્રેમ્પટન સીટી કાઉન્સિલર્સ; માનનીય કેથેરિન મેકેન્ના (Catherine McKenna), ફેડરલ મિનિસ્ટર ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ કમ્યુનિટીસ વતી, મનિન્દર સિધુ (Maninder Sidhu), મિનિસ્ટર ઓફ ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટના પાર્લામેન્ટરી સેક્રેટરી અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ ફોર બ્રેમ્પટન ઇસ્ટ; અને માનનીય લૉરી સ્કોટ (Laurie Scott), ઓન્ટેરિયો'સ મિનિસ્ટર ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વતી, માનનીય પ્રબમીત સિંહ સરકારિયા (Prabmeet Singh Sarkaria), એસોસિએટ મિનિસ્ટર ઓફ સ્મોલ બિઝનેસ એન્ડ રેડ ટેપ રિડકશન અને મેમ્બર ઓફ પ્રોવિન્સિયલ પાર્લામેન્ટ ફોર બ્રેમ્પટન સાઉથ; દ્વારા બ્રેમ્પટન ટ્રાન્ઝિટ ફિલ્ટમાં બસો પર કોમ્પ્યુટર એઈડેડ ડિસ્પેચ એન્ડ ઓટોમેટિક વેલિકલ લોકેશન સિસ્ટમ્સના રિપ્લેસમેન્ટ માટે સહયોગી ભંડોળની ઘોષણા કરવામાં આવી.

ગવર્નમેન્ટ ઓફ કેનેડા ઇન્વેસ્ટિંગ ઇન કેનેડા યોજનાની પબ્લિક ટ્રાન્ઝિટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટ્રીમ (PTIS) મારફતે આ પ્રોજેક્ટમાં \$4 મિલિયનનું રોકાણ કરી રહ્યું છે. ગવર્નમેન્ટ ઓફ ઓન્ટેરિયો \$3.3 મિલિયનનું ભંડોળ, અને સીટી ઓફ બ્રેમ્પટન \$2.6 મિલિયનનો ફાળો પૂરું પાડી રહ્યું છે.

આ પ્રોજેક્ટમાં કોમ્પ્યુટર એઈડેડ ડિસ્પેચ એન્ડ ઓટોમેટિક વેલિકલ લોકેશન સિસ્ટમ્સ માટે બધાં સહાયક ડિવાઈસીસ, ઓપરેટિંગ સિસ્ટમ્સ, નેટવર્કિંગ ગીયર, અને સોફ્ટવેરની ડિઝાઈન, નિર્માણ, અને ઇન્સ્ટોલેશનનો સમાવેશ થાય છે. આ રિપ્લેસમેન્ટ સિસ્ટમ્સ 450 ઉપરાંત બસો પર ઇન્સ્ટોલ કરવામાં આવશે. કામમાં ઇન્ટરએક્ટિવ વોઈસ રિસ્પોન્સ, ડેટા રેડિયો નેટવર્ક, ટર્મિનલ્સ અને સ્ટેશન સ્ટોપ્સ પર 130 ઉપરાંત ઇલેક્ટ્રોનિક સાઈન્સ, અને ઓટોમેટિક પેસેન્જર કાઉન્ટર્સ સાથે બસોનું આઉટફિટિંગ સહિતની, સબસિસ્ટમ્સનું અમલીકરણ અને એકીકરણનો સમાવેશ પણ થાય છે.

આ નવી સિસ્ટમ્સ ઉમેરાવાથી ડેટાની વિશ્વસનીયતા, સંચાલનલક્ષી પગેરું, સિસ્ટમની ક્ષમતા, અને કામગીરીમાં સુધારો થશે, અને બ્રેમ્પટન માટે વધારે સારી ગુણવત્તા અને વધારે સુરક્ષિત પબ્લિક ટ્રાન્ઝિટ સિસ્ટમ બની રહેશે.

કડીઓ (લિંક્સ)

- [કેનેડા અને ઓન્ટેરિયો બ્રેમ્પટનવાસીઓ માટે સુધારેલી પબ્લિક ટ્રાન્ઝિટમાં રોકાણ કરશે](#)

અવતરણો (ક્વોટ્સ):

“સીટી ઓફ બ્રેમ્પટન આપણી પબ્લિક ટ્રાન્ઝિટ સિસ્ટમમાં આ નોંધપાત્ર રોકાણને આવકારે છે. બ્રેમ્પટન ટ્રાન્ઝિટ કેનેડામાં સૌથી ઝડપથી વિકસતા ટ્રાન્ઝિટ નેટવર્ક્સમાંનું એક છે, અને અદ્યતન ડિસ્પેચ એન્ડ વેલિકલ લોકેશન ટેકનોલોજીસથી બ્રેમ્પટનમાં જાહેર પરિવહનની વાસ્તવિક સમયે માહિતી, જોડાણ, ગુણવત્તા અને સુરક્ષામાં સારો એવો સુધારો થશે. હું બ્રેમ્પટનમાં રોકાણ લાવવા સરકારના બધાં સ્તરો સાથે કામ ચાલુ રાખવાની આશા રાખું છું.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

“બ્રેમ્પટન એક આરોગ્યપ્રદ અને સુરક્ષિત અને સુસંચાલિત શહેર છે. આ મહત્વના રોકાણથી આપણી ટ્રાન્ઝિટ સિસ્ટમ આધુનિક, કાર્યક્ષમ, અને સારી રીતે જોડાયેલી હોવાની ખાતરી થશે. અમે બ્રેમ્પટન ટ્રાન્ઝિટ પાસે પોતાના રોજિંદા સંચાલનો, સુરક્ષા, અને વૃદ્ધિને સહાયરૂપ થવા, અને આપણાં સમુદાયની દરેક વ્યક્તિ માટે સૌથી અદ્યતન ટેકનોલોજીસ હોવાની ખાતરી કરવાનું ચાલુ રાખીશું. આને શક્ય બનાવનાર આપણાં સરકારી ભાગીદારો, કર્મચારીગણ, અને હિતધારકોનો આભાર.”

- પૉલ વિસેંટે (Paul Vicente), પ્રાદેશિક કાઉન્સિલર, વોર્ડ્સ 1 અને 5; અધ્યક્ષ, પબ્લિક વર્ક્સ એન્ડ એન્જનીયરિંગ, સીટી ઓફ બ્રેમ્પટન

“સીટીના કર્મચારીઓ બ્રેમ્પટનમાં રોકાણ લાવવા આપણાં ભાગીદારો સાથે કામ ચાલુ રાખવા સમર્પિત છે. આપણે બ્રેમ્પટન ટ્રાન્ઝિટ પર આ ડિવાઈસીસ અને સિસ્ટમ્સ બદલીએ, અમલમાં મૂકીએ અને એકીકૃત કરીએ ત્યારે આપણાં બસોના કાફલાને અને સમુદાયને સારો એવો લાભ થશે.”

- ડેવિડ બારિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રેમ્પટન

“આજના રોકાણથી ડેટા વિશ્વસનીયતા અને સંચાલનલક્ષી પગેરું અને ક્ષમતાઓ અપગ્રેડ કરીને બ્રેમ્પટનની પબ્લિક ટ્રાન્ઝિટની માળખાગત સગવડો સુધારવામાં મદદ મળશે. આનાથી રહેવાસીઓ આગામી વર્ષો માટે ગુણવત્તાસભર અને સુરક્ષિત પબ્લિક ટ્રાન્ઝિટ વિકલ્પો સુધી સતત પહોંચ ધરાવતા હોવાની ખાતરી થશે. કેનેડાનો ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાન હજારો પ્રોજેક્ટ્સમાં રોકાણ કરે છે, દેશભરમાં રોજગારનું સર્જન કરે છે, અને વધારે સાફ, વધારે સર્વગ્રાહી સમુદાયોનું નિર્માણ કરે છે.”

- માનનીય કેથેરિન મકેન્ના (Catherine McKenna), ફેડરલ મિનિસ્ટર ઓફ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ કમ્યુનિટીસ વતી, મનિન્દર સિધુ (Maninder Sidhu), મિનિસ્ટર ઓફ ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટના પાર્લામેન્ટરી સેક્રેટરી અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ ફોર બ્રેમ્પટન ઈસ્ટ

“એક વિકસતા શહેર તરીકે, આપણાં લોકોને આપણાં સમુદાયમાં અવરજવર કરતા રાખવા બ્રેમ્પટનને સુરક્ષિત, ઝડપી, અને પહોંચ સુલભ ટ્રાન્ઝિટની જરૂર છે. આ રોકાણ આપણાં સમુદાય માટે આધુનિક, અસરકારક અને કાર્યક્ષમ ટ્રાન્ઝિટનું નિર્માણ ચાલુ રાખવા વિશે છે—જેથી કરીને મહેનતુ બ્રેમ્પટન કુટુંબો આગળ વધવાની દરેક તકનો લાભ લઈ શકે છે.”

- માનનીય લૉરી સ્કોટ (Laurie Scott), ઓન્ટેરિયો'સ મિનિસ્ટર ઓફ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વતી, માનનીય પ્રબમીત સિંહ સરકારિયા (Prabmeet Singh Sarkaria), એસોસિએટ મિનિસ્ટર ઓફ સ્મોલ બિઝનેસ એન્ડ રેડ ટેપ રિડક્શન અને મેમ્બર ઓફ પ્રોવિન્સિયલ પાર્લામેન્ટ ફોર બ્રેમ્પટન સાઉથ

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 7,00,000 કરતા વધુ લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca.

મીડિયા સંપર્કો :

મોનિકા દુગ્ગલ (Monika Duggal)
કોર્ડિનેટર, મીડિયા એન્ડ કમ્યુનિટી એન્ગેજમેન્ટ
સ્ટ્રેટેજિક કમ્યુનિકેશન
સીટી ઓફ બ્રેમ્પટન
905-874-3426 | Monika.Duggal@brampton.ca

ચેન્ટલી ઓબર્ટિન (Chantalle Aubertin)
પ્રેસ સેક્રેટરી (Press Secretary)
ઓફિસ ઓફ ધી મિનિસ્ટર ઓફ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ કમ્યુનિટીસ
613.941.0660 | chantalle.aubertin@canada.ca

Media Release

ક્રિસ્ટાઈન બુજોલ્ડ (Christine Bujold)
પ્રેસ સેક્રેટરી (Press Secretary)
ઓફિસ ઓફ ધી ઓનરેબલ લોરી સ્કોટ, ઓન્ટેરિયો'સ મિનિસ્ટર ઓફ
ઇન્ફ્રાસ્ટ્રક્ચર
416.454.1782 | christine.bujold@ontario.ca

સોફિયા સોસા-ડિઆસ (Sofia Sousa-Dias)
કોમ્યુનિકેશન્સ બ્રાંચ (Communications Branch)
ઓન્ટેરિયો મિનિસ્ટ્રી ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (Ontario Ministry of
Infrastructure)
437.991.3391 | sofia.sousa-Dias@ontario.ca

મીડિયા રિલેશન્સ (Media Relations)
ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેનેડા (Infrastructure Canada)
613-960-9251
ટોલ ફ્રી: 18.77.250.7154
ઇમેલ: infc.media.infc@canada.ca
અમને [Twitter](#), [Facebook](#) અને [Instagram](#) પર અનુસરો
વેબ: [ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેનેડા \(Infrastructure Canada\)](#)